

ભારતીય જનતા પાર્ટી

ગુજરાત પ્રદેશ

શ્રી કમલમ્



પ્રેક્ષા વિશ્વ ભારતીની સામે, કોબા સર્કલ-ગાંધીનગર રોડ, કોબા, ગાંધીનગર-૩૮૨૦૦૭ (ગુજરાત)

Phone : (079) 23276947, 23276948, 23276949 Fax : (079) 23276943 • Email : bjp.gujarat@gmail.com • Web : www.bjpgujarat.org

પ્રેસનોટ-૦૯

તા. ૧૧.૦૪.૨૦૧૯

ભારત દેશ મહાસત્તા બનવા તરફ આગળ જઈ રહ્યો છે, અવકાશમાં ઉપગ્રહ છોડી પણ શકે છે અને તેને તોડી પણ શકે છે - શ્રી વિજયભાઈ રૂપાણી

શ્રી નરેન્દ્રભાઈ મોદીના કારણે દેશ પાંચ વર્ષ સુધી સ્થિરતાથી ચાલ્યો છે. દેશનો ઘણો વિકાસ થયો છે. દુનિયા પણ શ્રી નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ સ્વીકારવા તૈયાર છે - શ્રી વિજયભાઈ રૂપાણી

ગુજરાત સરકારે ત્રણ વર્ષમાં રૂ. ૮૫૦૦ કરોડની ટેકાના ભાવથી ખરીદી કરી હતી. ગુજરાત સરકારે પાક વિમાના રૂ. ૨૬૦૦ કરોડ ખેડૂતોને અપાવ્યાં છે. ખેડૂતોના ખાતામાં ૬,૦૦૦ રૂપિયા સીધાજ જમાં કરવામાં આવે છે - શ્રી વિજયભાઈ રૂપાણી

કોંગ્રેસે ખેડૂતોને ૧૬ ટકાના વ્યાજે લોન આપી હતી, જ્યારે ભાજપા સરકાર ખેડૂતોને ઝીરો ટકા વ્યાજથી લોન આપી રહી છે.

પુલવામાના શહીદ વીર જવાનોની શહીદીનો બદલો લેવા માટે દેશના સૈન્યએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો હતો. આવી હિંમત માત્રને માત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદી જ કરી શકે છે - શ્રી વિજયભાઈ રૂપાણી

ગુજરાતની રોયલ્ટીના ૧૦,૦૦૦ કરોડ રૂપિયા કોંગ્રેસ સરકાર આપતી ન હતી. શ્રી નરેન્દ્રભાઈની સરકાર બનતાં જ તે પૈસા આપણને તરત મળી ગયાં - શ્રી વિજયભાઈ રૂપાણી

માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ધંધુકા ખાતે એક વિશાળ જનમેદનીને સંબોધતાં જણાવ્યું હતું કે, આ વખતની ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો ગણીએ તો આ દેશ કોના હાથમાં સલામત છે? ભારતમાતાને કોણ શક્તિશાળી બનાવશે? પહેલા ભારત દેશ ગરીબ, ભિખારી, ગંદકીથી ખદબદતો દેશ ગણાતો હતો. તે હવે આપણા લોકવાડીવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ સ્વચ્છ, સુંદર અને સમૃદ્ધ બનતો જાય છે.

ભારત દેશ મહાસત્તા બનવા તરફ આગળ જઈ રહ્યો છે, અવકાશમાં ઉપગ્રહ છોડી શકે છે અને તેને તોડી પણ શકે છે. શ્રી નરેન્દ્રભાઈએ પ્રજાના નાણાં પ્રજાહિતના કાર્યો માટે જ વપરાય તેની ખાસ ચિંતા કરી છે અને તેઓ તેના માટે સજગ છે. સાથે સાથે પ્રજા પણ આ દેશમાં કંઈક સારું થાય તે માટે કરોડો લોકો મૈ ભી ચોકીદારના નારા સાથે શ્રી નરેન્દ્રભાઈ મોદીની સાથે ખભે ખભા મિલાવીને ઊભા છે. આ વખતની ચૂંટણી સ્થિરતા અને અસ્થિરતા વચ્ચેની છે, શ્રી નરેન્દ્રભાઈ મોદીના કારણે દેશ પાંચ વર્ષ સુધી સ્થિરતાથી ચાલ્યો છે. દેશનો ઘણો વિકાસ થયો છે. દુનિયા પણ શ્રી નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ સ્વીકારવા તૈયાર છે, ત્યારે “ફીર એકબાર મોદી સરકાર” એ આપણા ભારત દેશની જનતા સૂત્ર

ભારતીય જનતા પાર્ટી

ગુજરાત પ્રદેશ

શ્રી કમલમ્



પ્રેક્ષા વિશ્વ ભારતીની સામે, કોબા સર્કલ-ગાંધીનગર રોડ, કોબા, ગાંધીનગર-૩૮૨૦૦૭ (ગુજરાત)

Phone : (079) 23276947, 23276948, 23276949 Fax : (079) 23276943 • Email : bjp.gujarat@gmail.com • Web : www.bjpgujarat.org

..૨..

બની ગયું છે. બીજી બાજુ ગઠબંધન અને કોંગ્રેસની સરકાર બનશે, તો દેશમાં અસ્થિરતા ઊભી થશે, ફરીથી ભ્રષ્ટાચારનો વ્યાપ વધી જશે, આતંકવાદીઓ માઝા મૂકશે અને દેશ ફરીથી બે દાયકા પાછળ પડી જશે. હવે તમારે નક્કી કરવાનું છે કે, આપણે દેશને પાછળ ધકેલવો છે કે આગળ વધારવો છે.

આ વખતની ચૂંટણી રાષ્ટ્રવાદ અને પરિવારવાદની છે. આપણાં માટે દેશહિત જ સર્વોપરી છે, જ્યારે બીજી તરફ માત્ર અને માત્ર પરિવારવાદની વાત છે. અમારો પરિવાર જ દેશ ઉપર રાજ કરે તેવી કોંગ્રેસની માનસિકતા છે. આજે કોંગ્રેસ ગાંધી પરિવારના કલબલિયા વગાડીને માત્ર એક જ રાગ આલાપે છે કે, મોટી હટાવો... મોટી હટાવો.... શ્રી વિજયભાઈ રૂપાણીએ વીર જવાનોને યાદ કરી જણાવ્યું હતું કે, આપણા વીર જવાનો શૌર્યથી ભરપુર છે. તેઓ આજે પણ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છે. આપણાં જવાનો સરહદ ઉપર આપણાં સૌની રક્ષા કરે છે, ત્યારે આપણે સૌ શાંતિથી સૂઈ શકીએ છીએ. પુલવામાના શહીદ વીર જવાનોની શહીદી માટે પાકિસ્તાનમાં ધૂસીને આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો હતો. આવી હિંમત માત્રને માત્ર શ્રી નરેન્દ્ર ભાઈ મોદી જ કરી શકે છે.

કોંગ્રેસની સરકારે ૨૫ વર્ષમાં ખેડૂતો માટે રૂ. ૧૨૦૦ કરોડની ટેકાના ભાવે ખરીદી કરી હતી. જ્યારે માત્ર ગુજરાત સરકારે ત્રણ વર્ષમાં રૂ. ૮૫૦૦ કરોડની ટેકાના ભાવથી ખરીદી કરી હતી. ગુજરાત સરકારે પાક વિમાના રૂ. ૨૬૦૦ કરોડ ખેડૂતોને અપાવ્યાં છે. ખેડૂતોના ખાતામાં ૬,૦૦૦ રૂપિયા સીધાજ જમાં કરવામાં આવે છે. મગફળીની ૪.૫ લાખ ટન ખરીદી ગુજરાત સરકારે આ વર્ષે કરી છે. કોંગ્રેસે ખેડૂતોને ૧૬ ટકાના વ્યાજે લોન આપી હતી, જ્યારે ભાજપા સરકાર ખેડૂતોને ઝીરો ટકા વ્યાજથી લોન આપી રહી છે. આજે નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર - કચ્છ સુધી પહોંચાડ્યું છે. કોંગ્રેસે ૭ વર્ષ સુધી નર્મદા ડેમના દરવાજાની મંજૂરી આપી નહોતી. શ્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યાનાં માત્ર ૧૭ દિવસમાં જ તેની મંજૂરી આપી દિધી હતી. ગુજરાતની રોયલ્ટીના ૧૦,૦૦૦ કરોડ રૂપિયા કોંગ્રેસ સરકાર આપતી ન હતી. શ્રી નરેન્દ્રભાઈની સરકાર બનતાં જ તે પૈસા આપણને તરત મળી ગયાં. ભાજપાની સરકારે ગુજરાતને રેલ્વે યુનિવર્સિટી આપવાની ખાત્રી આપી છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીને ખબર છે કે ધોળકાને શું જોઈએ છે અને ધંધુકાને શું જોઈએ છે.

૨૩મી તારીખે કમળ નું બટન દબાવીને કોંગ્રેસને સાફ કરવાનો આપણી પાસે મોકો છે આપ સૌ શ્રી નરેન્દ્ર ભાઈ ના હાથ મજબૂત કરીને દેશમાં પૂર્ણ બહુમતીવાળી ભાજપા સરકારને ફરીથી દિલ્હીની ગાદી પર બેસાડો છો તેવી આપ સૌને મારી નમ્ર અપીલ છે

શ્રી વિજયભાઈ રૂપાણીની આ જાહેરસભામાં ભીમનાથ મહાદેવના મહામંડલેશ્વર, રાજ્યસભાના સાંસદ શ્રી શંભુપ્રસાદ ટુંડીયા, પૂર્વસાંસદ શ્રી શંકરભાઈ વેગડ, ગુજરાત પ્રદેશ ભાજપાના પ્રવક્તા શ્રી ભરતભાઈ પંડ્યા, સુરેન્દ્રનગર લોકસભાના બેઠકના ભાજપાના ઉમેદવાર ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, શ્રી નીતિનભાઈ ભારદ્વાજ, શ્રી કુશળસિંહ પટેરીયા અને શ્રી નવદીપભાઈ ડોડીયા ઉપસ્થિત રહ્યાં હતાં.

(પ્રશાંત વાળા)

પ્રદેશ કન્વીનર, મીડીયા વિભાગ